



Masjiden Khushbudaar Rakhiye (Gujarati)

જિલ્લા ક્રમ-47

મસ્જિદે ખુશબૂદાર રખિયે



શીખે તરીકત, અમીરે અહલે સુન્નાત, બ્રાનિયે દા'વતે ઇસ્લામી. હાસ્ત અલ્લામા મૌલાના અબુ સિવાય

મુહમ્મદ ઇબ્લાસ અત્તાર કાદિરી ૨-ઝવી

کاتب تہذیب و فہم
الاسلامیہ

مکتبۃ المدینہ
(دعوت اسلامی)

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

કિતાબ પઢને કી દુઆ

અઝ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી, હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી ડામ્ત બ્રોકાત્હેમુલ્લાહી
દીની કિતાબ યા ઈસ્લામી સબક પઢને સે પહલે ઝૈલ મેં દી હુઈ દુઆ પઢ લીજિયે
إِنَّ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ જો કુછ પઢેંગે યાદ રહેગા. દુઆ યેહ હૈ :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَأَنْشُرْ
عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

તરજમા : ઐ અલ્લાહ! હમ પર ઈલ્મો હિક્મત કે દરવાઝે ખોલ દે ઔર હમ પર અપની રહમત નાઝિલ ફરમા ! ઐ અ-ઝમત ઔર બુજુર્ગી વાલે. (المستطرف ج ١ ص ٤٠٤ دار الفكر بيروت)
નોટ : અવ્વલ આખિર એક એક બાર દુરૂદ શરીફ પઢ લીજિયે.

તાલિબે ગમે મદીના
વ બકીઅ
વ મગિફરત
13 શવ્વાલુલ મુકર્રમ 1428 હિ.



મસ્જિદે ખુશબૂદાર રખિયે

યેહ રિસાલા (મસ્જિદે ખુશબૂદાર રખિયે)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી ઝિયાઈ ડામ્ત બ્રોકાત્હેમુલ્લાહી ને ઉર્દૂ ઝબાન મેં તહરીર ફરમાયા હૈ.

મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી) ને ઈસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ કિયા હૈ ઔર મક-ત-બતુલ મદીના સે શાએઅ કરવાયા હૈ. ઈસ મેં અગર કિસી જગહ કમી બેશી પાએં તો મજલિસે તરાજિમ કો (બ ઝરીઅએ મક્તૂબ, ઈ-મેઈલ યા SMS) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઈયે.

રાખિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)

મક-ત-બતુલ મદીના, સિલેક્ટેડ હાઉસ, અલિફ કી મસ્જિદ કે સામને,
તીન દરવાઝા, અહમદઆબાદ-1, ગુજરાત, ઈન્ડિયા

MO. 9374031409 • E-mail : translationmaktabhind@dawateislami.net

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
مَا بَعُدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ



મસ્જિદે



ખુશબૂદાર રખિયે

શૈતાન લાખ સુસ્તી દિલાએ મગર યેહ રિસાલા (23 સફહાત)
પૂરા પઠ કર અપની આબિરત કા ભલા કીજિયે.

દુરુદ શરીફ કી ફઝીલત

અલ્લાહ ઈબ્રાહીમ કે મહબૂબ, દાનાએ ગુયૂબ, મુનઝઝહુન અનિલ

ઉયૂબ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને આલીશાન હૈ : જિસ ને મુઝ પર દિન ભર મેં એક હઝાર મર્તબા દુરુદે પાક પઠા વોહ ઉસ વક્ત તક નહીં મરેગા જબ તક જન્મત મેં અપની જગહ ન દેખ લે. (الترغيب والترهيب ج ٢ ص ٣٢٨ حديث ٢٢)

صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

મસ્જિદ મેં બલગમ દેખ કર સરકાર કી ના ગવારી

એક મર્તબા હુઝૂરે અકરમ, નૂરે મુજસ્સમ, શાહે બની આદમ, રસૂલે મુહુતશમ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને મસ્જિદુન્ન-બવિયિયશરીફ મેં કિબલે કી તરફ બલગમ પડી દેખી તો ના રાઝગી કા ઈઝહાર ફરમાયા. યેહ દેખ કર એક અન્સારી સહાબિયા ઉઠીં ઓર ઉસે ખુરચ કર સાફ કર કે વહાં ખુશબૂ લગા દી. આપ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને મસરત આમેઝ લહજે મેં ઈશાદિ ફરમાયા : **يَا مَآ أَحْسَنَ هَذَا** ઈસ ખાતૂન ને કિતના હી ઉમ્દા કામ કિયા હૈ.

(نَسَائِي ص ١٢٦ حديث ٧٢٥)

करमाने मुस्तफा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज पर ओक बार दुरेदे पाक पढा अल्लाह उंस पर दस रउमतें भेजता है. (स्ल)

झाड़के आ'उम और मस्जिद में पुरशू

सय्यिदुना झाड़के आ'उम رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ हर जुमुअतुल मुबारक को मस्जिदुन्न-अवियिशरीफ صَلَوَاتُهَا الصَّلَاةُ وَالسَّلَامُ में पुरशू की धूनी दिया करते थे. (مُسْنَدُ أَبِي يَعْلَى ج ١ ص ١٠٣ احديث ١٨٠)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

मस्जिदें पुरशूदार रभिये !

उम्मुल मुअमिनीन हजरते सय्यि-दतुना आ'इशा सिदीका रिवायत इरमाती हैं : हुजुरे पुरनूर, शाईअे यौमुनुशूर ने महल्लों में मस्जिदें बनाने का हुकम दिया और येह के वोह साइ और पुरशूदार रभी जाअें.

(ابوداؤد ج ١ ص ١٩٧ احديث ٤٠٠)

अयर इेशनर से के-सर हो सकता है

मीठे मीठे इस्लामी भाईयो ! मा'लूम हुवा मस्जिदें उिद, लूबान और अगरबत्ती वगैरा से पुरशूदार रभना कारे सवाब है. मगर मस्जिद में अैसी दिया सलाई (या'नी मायिस की तीली) न जलाईये जिस से झाड़के की बढभू निकलती है क्यूंके मस्जिद को बढभू से बयाना वाजिब है. झाड़के का बढभूदार धुवां अन्दर न आने पाअे ईतनी दूर बाहर से लूबान या अगरबत्ती वगैरा सुलगा कर मस्जिद में लाईये. अगरबत्तियों को किसी बडे तश्त वगैरा में रभना जरूरी है ता के ईस की राभ मस्जिद के इर्श वगैरा पर न गिरे. अगरबत्ती के

करमाने मुस्तकी: عَلَى اللَّهِ تَعَالَى غَيْرُ الْيَهُودِ وَالنَّسْرِيِّ: श्री शिप्स मुज पर दुरेद पाक पढना भूल गया वोह जन्त की रास्ता भूल गया. (جران)

पेकिट पर अगर जानदार की तस्वीर बनी हुई हो तो उस को पुरय डालिये. मस्जिद (नीज घरों और कारों वगैरा) में “अेयर फ़ेशनर” (AIR FRESHNER) से पुरुषू का छिडकाव मत कीजिये के उस के कीमियावी मादे इजा में डैल जाते और सांस के जरीअे डेडों में पड़ोय कर नुकसान पड़ोयाते हैं. अेक तिब्बी तलकीक के मुताबिक अेयर फ़ेशनर के इस्ति’माल से जिल्द का सरतान या’नी (SKIN CANCER) हो सकता है. जहां उई हो वहां मस्जिद के यन्दे से पुरुषू सुलगाने की इजाजत है और जहां उई न हो वहां पुरुषू की सराहत कर के अलग से यन्दा डालिये करें.

मुंड में बढभू हो तो मस्जिद में जाना हराम है

भीठे भीठे इस्लामी भाईयो ! भूक से कम खाने की आदत बनाईये या’नी अन्बी ज्वालिश बाकी हो, के डाय रोक लीजिये. अगर भूख उट कर खाते रहे और वक्त बे वक्त सीप कबाब, बर्गर, आलू छोले, पिज़्जे, आइसकीम, ठन्डी बोतलें वगैरा पेट में पड़ोयाते रहे, पेट भराने हो गया और भुदा न ज्वास्ता “गन्दा द-डनी” या’नी मुंड से बढभू आने की बीमारी लग गई तो सप्त इम्तिडान हो जाअेगा, क्यूंके मुंड से बढभू आती हो तो मस्जिद का दाखिला हराम है, यहां तक के जिस वक्त मुंड से बढभू आ रही हो उस वक्त बा जमाअत नमाज पढने के लिये भी मस्जिद में आना गुनाह है. यूंके डिके आभिरत की कमी के बाईस लोगों की भारी अकसरियत में खाने की डिर्स जियादा और आज कल हर तरफ़ “डूड कल्यर” का

﴿ كَرَّمَانِ مُسْتَكْفٍ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ﴾ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझे पर दुर्रद पाक न पढा तहकीक
 वोह बढ भप्त हो गया. (अन)

दौर दौरा है, इस वजह से एक ता'दाह है जिन के मुंह से बढभू आती है. मुझे बारहा का तजरिबा है के जब कोई मुंह करीब कर के बात करता है तो उस के मुंह की बढभू के सबब सांस रोकना पडता है. भा'ज अवकात इमाम व मुअज्जिन को भी गन्दा द-हनी का भरज हो जाता है, अइसा हो तो इन्हें झौरन छुट्टियां ले कर इलाज करना याहिये क्यूंके मुंह में बढभू होने की सूरत में मस्जिद के अन्दर दाभिल होना हराम है. अइसोस ! बढभूदार मुंह वाले कई अइराद मस्जिद के अन्दर मो'तकिइ भी हो जाते हैं. याद रबिये ! शर-ई हुकम येह है के अगर दौराने अ'तिकाइ भी मुंह में बढभू का भरज हो जाये तो अ'तिकाइ तोड कर मस्जिद से यला जाना होगा. भा'द में एक दिन के अ'तिकाइ की कजा कर ले. र-मजानुल मुबारक में कबाब समोसे और दीगर तली हुई चीजें और तरह तरह की मुरगन गिजाअें ठूस ठांस कर खाने के सबब मुंह की बढभू वाले मरीजों में इजाफा हो जाता है, इस का बेहतरीन इलाज येह है के सादा गिजा और वोह भी भूक से कम खाओ और हाजिमा दुरुस्त रहे. नीज जब भी खा चुके भिलाव करने और भूब अखी तरह कुल्हियां वगैरा कर के मुंह साइ रबने की आदत बनाओ वरना गिजा के अजजा दांतों के खला (GAPE) में रह जाते, सडते और बढभू लाते हैं. सिई मुंह ही की बढभू नहीं हर तरह की बढभू से मस्जिद को बयाना वाजिब है.

मुंह में बढभू हो तो नमाज मकडूह होती है

इतावा र-जविय्या जिहद 7 सइहा 384 पर है : मुंह में बढभू होने की हालत में (घर में पढी जाने वाली) नमाज भी मकडूह

﴿ فرماتے مستحقاً صلى الله تعالى عليه وآله وسلم : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुइद शरीफ़ न पढा उस ने जडा की. (عمر الزق) ﴾

इरमाया : “अगर जाना ही याहते हो तो पका कर उस की भू दूर कर लो.”

(ابوداؤد ج ३ ص ००६ حديث ३८२७)

मस्जिद में कय्या गोशत न ले जायें

सदरुशशरीअह, बदरुत्तरीकह हजरते अल्लामा मौलाना

मुफ़्ती मुहम्मद अमजद अली आ'जमी عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِي इरमाते हैं :

मस्जिद में कय्या लहसुन और कय्यी पियाज जाना या भा कर जाना

जाईज नहीं जब तक के भू बाकी हो और येही हुक्म हर उस यीज का

है जिस में भू हो जैसे गिन्हना (येह लहसुन से मिलती जुलती तरकारी

है) मूली, कय्या गोशत और मिट्टी का तेल, वोह दिया सलाई जिस के

रगडने में भू उडती हो, रियाह पारिज करना वगैरा वगैरा. जिस

को गन्दा ह-हनी का आरिजा (या'नी मुंह से बढभू आने की बीमारी)

या कोई बढभूदार जम्म हो या कोई बढभूदार दवा लगाई हो तो

जब तक भू मुन्कतेअ (या'नी अत्म) न हो उस को मस्जिद में आने की

मुमा-न-अत है. (बहारे शरीअत, जि. 1, स. 648) कय्या गोशत वगैरा

पाक यीज की अगर ईस तरह पेकिंग कर ली जाये के मा'भूली सी ली

बढभू न आये तो अब मस्जिद में ले जाने में हरज नहीं.

कय्यी पियाज वाले कयूमर और राईते से मोहतात रडिये

कय्यी पियाज वाले यने, छोले, राईते और कयूमर नीज

कय्ये लहसुन वाले अयार यटनी वगैरा जाने से नमाज के अवकात

में परहेज कीजिये. आ'ज अवकात कबाअ समोसे वगैरा में ली कय्यी

पियाज और कय्ये लहसुन की भू महसूस होती है लिहाजा नमाज से

पहले ईन को ली न पाईये. ऐसी भू वाली यीजें मस्जिद में लाने की

ली ईजाजत नहीं.

ફરમાને મુસ્તકી عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો મુઝ પર રોઝે જુમુઆ દુરુદ શરીફ પઢેગા મેં કિયામત કે દિન ઉસ કી શકાઅત કરૂંગા. (કુબ્રાલ)

મજમઅ મેં અગરબત્તી સુલગાના

મુસલમાનોં કે ઈજતિમાઅ મેં ખુશબૂ પહોંચાને કી નિચ્ચત સે અગરબત્તી વગૈરા જલાના કારે સવાબ હૈ. અગર લૂબાન યા અગરબત્તી કે ધૂએં સે કિસી કો તકલીફ હોતી હો તો એસે મૌકઅ પર ખુશબૂ ન જલાઈ જાએ ઈસી તરહ મજમઅ પર ઝિયાદા મિકદાર મેં “ખુશબૂદાર પાની” છિડકને સે ભી બચેં કે આમ તૌર પર ઈસ સે લોગોં કો કોફત ઔર પરેશાની હોતી હૈ.

બદબૂદાર મુંહ લે કર મુસલમાનોં કે મજમઅ મેં જાને કી મુમા-ન-અત

મુફ્સિરે શહીર હકીમુલ ઉમ્મત હઝરતે મુફતી અહમદ યાર ખાન عَلَيْهِ رَحْمَةُ الرَّحْمَان ફરમાતે હૈં : મુસલમાનોં કે મજમઓં, દર્સે કુરઆન કી મજલિસોં, ઉ-લમાએ દીન વ ઔલિયાએ કામિલીન કી બારગાહોં મેં બદબૂદાર મુંહ લે કર ન જાઓ. મઝીદ ફરમાતે હૈં : જબ તક મુંહ મેં બદબૂ રહે ઘર મેં હી રહો, મુસલમાનોં કે જલ્સોં, મજમઓં મેં ન જાઓ. હુક્કા પીને વાલે, તમ્બાકૂ વાલે, પાન ખા કર કુલ્લી ન કરને વાલોં કો ઈસ સે ઈબ્રત પકડની ચાહિયે. ફુ-કહાએ કિરામ رَحْمَةُ اللَّهِ السَّلَام ફરમાતે હૈં : જિસે ગન્દા દ-હની કી બીમારી હો ઉસે મસ્જિદોં કી હાઝિરી મુઆફ હૈ. (મિરઆતુલ મનાજ્જહ, જિ. 6, સ. 25, 26)

નમાઝ કે અવકાત મેં કચ્ચી પિયાઝ ખાના કૈસા ?

સુવાલ : “ગન્દા દહન” કો મસ્જિદ કી હાઝિરી મુઆફ હૈ, તો કયા કચ્ચી પિયાઝ વાલા રાઈતા યા કચૂમર યા એસે કબાબ સમોસે જિન મેં લહ્સન પિયાઝ બરાબર પકે હુએ ન હોં ઔર ઉન કી બૂ આતી હો યા મસલી હુઈ બાજરે કી રોટી જિસ મેં કચ્ચા લહ્સન શામિલ હોતા હૈ એસી ગિઝા વગૈરા જમાઅત સે કુછ દેર પહલે ઈસ નિચ્ચત સે ખા

﴿إِذْ قَالَ رَبِّي يَا كَافِرِينَ كَيْفَ يُغْنِي عَنْكَ كُنُوزُكَ إِذَا نَسَّكَ اللَّهُ وَنَسَّكَ اللَّهُ مَنَاسِكَ﴾

સકતે હૈં કે મુંહ મેં બૂ હો જાએ ઓર જમાઅત વાજિબ ન રહે !

જવાબ : એસા કરના જાઈઝ નહીં. મ-સલન જહાં ઈશા કી જમાઅત અવ્વલ વક્ત મેં હોતી હૈ વહાં નમાઝે મગરિબ કે બા'દ એસા ક્યૂમર યા સલાદ વગૈરા ન ખાએ જિસ મેં કચ્ચી મૂલી યા કચ્ચી પિયાઝ યા કચ્ચા લહ્સન હો કચૂંકે ઈતની જલ્દી મુંહ સાફ કર કે મસ્જિદ મેં પહોંચના દુશ્વાર હોતા હૈ. હાં અગર જલ્દ મુંહ સાફ કરના મુશ્કિન હૈ યા કિસી ઓર વજહ સે મસ્જિદ કી હાઝિરી સે મા'ઝૂર હૈ મ-સલન ઓરત. યા નમાઝ પઢને મેં અભી કાફી દેર હૈ ઉસ વક્ત તક બૂ ખત્મ હો જાએગી તો ખાને મેં મુઝા-યકા નહીં. મેરે આકા આ'લા હઝરત ઈમામે અહલે સુન્નત મુજદિદે દીનો મિલ્લત મૌલાના શાહ ઈમામ અહમદ રઝા ખાન **رَحْمَةُ الرَّحْمٰنِ عَلَيْهِ وَسَلَّمَ** ફરમાતે હૈં : કચ્ચા લહ્સન પિયાઝ ખાના, કે બિલા શુબ્હા હલાલ હૈ ઓર ઉસે ખા કર જબ તક બૂ ઝાઈલ ન હો મસ્જિદ મેં જાના મમ્નૂઅ મગર જો હુક્કા એસા કસીફ (ગાઢા) વ બે એહતિમામ હો કે **الْبَدْنِ** તગચ્ચુરે બાકી (યા'ની દેર પા બદબૂ) પૈદા કરે, કે વક્તે જમાઅત તક કુલ્લી સે ભી બ કુલ્લી (યા'ની મુકમ્મલ તૌર પર) ઝાઈલ ન હો તો કુર્બે જમાઅત મેં ઈસ કા પીના શરઅન ના જાઈઝ, કે અબ વોહ તર્કે જમાઅત વ તર્કે સજદા યા બદબૂ કે સાથ દુખૂલે મસ્જિદ કા મૂજિબ (સબબ) હોગા ઓર યેહ દોનોં મમ્નૂઅ વ ના જાઈઝ હૈં ઓર (યેહ શર-ઈ ઉસૂલ હૈ કે) હર મુબાહ ફી નર્ફિસહી (યા'ની હર વોહ કામ જો હકીકત મેં જાઈઝ હો મગર) અમ્મે મમ્નૂઅ કી તરફ મુઅદી (યા'ની મમ્નૂઅ કામ કી તરફ લે જાને વાલા) હો મમ્નૂઅ વ ના રવા હૈ. (ફતાવા ર-ઝવિયા, જિ. 25, સ. 94)

કચ્ચી પિયાઝ ખાતે વક્ત બિસ્મિલ્લાહ મત પઢિયે

ફતાવા ફૈઝુરસૂલ જિલ્દ 2 સફહા 506 પર હૈ : હુક્કા, બીડી,

﴿ كَرِهَ اللَّهُ مُشْرِكِيًّا ۚ عَلَيْهِمُ الضَّرْفَةُ لِمِيقَاتِهِمْ ۚ وَالَّذِينَ يَدْعُونَ بِهِمُ اسْمَ اللَّهِ وَرَوَيْتَهُمْ ۚ لَدُونَكَ ۚ ﴾ (ط. 1)

सिगरेट पीने और (कच्चे) लहसुन, पियाज जैसी चीज खाने के वक्त और नजासत की जगहों में बिस्मिल्लाह पढना मक़रूह है।

मुंह की बढबू मा'लूम करने का तरीका

अगर मुंह में कोई तगय्युरे राईछा (या'नी बढबू) हो तो जितनी बार मिस्वाक और कुद्लियों से उस (बढबू) का छजाला (या'नी दूर करना मुम्किन) हो (उतनी बार कुद्लियां वगैरा करना) लाज़िम है, ईस के लिये कोई छद मुकर्रर नहीं. बढबूदर कसीफ़ (गाढा) बे अहत्तियाती का हुक्का पीने वालों को ईस का ખयाल (रખना) सप्त ज़रूरी है और उन से ज़ियादा सिगरेट वाले को, के ईस की बढबू मुरक़क़ब तम्बाकू से (बी) सप्त तर और ज़ियादा देर पा है और इन सब से ज़ाईद अशद ज़रूरत तम्बाकू खाने वालों को है जिन के मुंह में उस का जिर्म (या'नी धूअें के बजाअे खुद तम्बाकू ही) दबा रहता और मुंह अपनी बढबू से बसा देता है. येह सब लोग वहां तक मिस्वाक और कुद्लियां करें के मुंह बिल्कुल साफ़ हो जाअे और भू का अस्लान निशान न रहे और ईस का ईम्तिहान यूं है के हाथ अपने मुंह के करीब ले जा कर मुंह षोल कर जोर से तीन³ बार छदक से पूरी सांस हाथ पर लें और मअन (या'नी झौरन) सूंधें. बिगैर ईस के अन्दर की बढबू खुद कम महसूस होती है और जब मुंह में बढबू हो तो मस्जिद में जाना हराम, नमाज़ में हाबिल होना मन्अ. ﴿لَا يَأْتِيَنَّكَ الْمُشْرِكُونَ﴾ (इतावा र-अविय्या मुभर्रज, जि. 1, स. 623)

मुंह की बढबू का छलाज

अगर किसी चीज के खाने के सबब मुंह में बढबू आती हो तो “हरा धनिया” खबा कर षाईये नीज गुलाब के ताज़ा या सूंधे हुअे फूलों से दांत मांजिये ﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا﴾ इअेदा होगा. हां अगर पेट

﴿ فرماتے ہو کہ اللہ تعالیٰ علیہ وسلم : جس نے میری قبر پر 100 بار "سُبْحَانَكَ اللَّهُمَّ" پڑھا تو میں اسے جہنم میں لے جاؤں گا۔ ﴾

की पराणी की वजह से बढभू आती हो तो “कमजोरी” (या’नी जाने में कमी करने) की सआदत हासिल कर के लूक की ब-र-कतें लूटने से **اِنَّ كَسْبَ اللّٰهِ عَزَّوَجَلَّ** टांगों और बदन के मुप्तलिफ़ हिस्सों के दई, कब्ज़, सीने की जलन, मुंड के छाले, बार बार होने वाले (या’नी दाईमी) नजले पांसी और गले के दई, मसूदों में पून आना वगैरा बहुत सारे अमराज के साथ साथ मुंड की बढभू से भी जान छूट जाओगी. लूक बाकी रहे इस तरह से कम जाने में **80** ईसद अमराज से बयत हो सकती है. (तफ़सीली मा’लूमात के लिये इँजाने सुन्नत के बाब “पेट का कुइले मदीना” का मुता-लआ इरमाईये) अगर नफ़स की हिर्स का ईलाज हो जाओ तो कई जिस्मानी और इहानी अमराज जुद ही दम तोड जाओं.

रजा नफ़स दुश्मन है दम में न आना

कहां तुम ने देखे हैं यंदराने वाले

(हदाईके बज्शिश शरीफ़)

मुंड की बढभू का म-दनी ईलाज

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى النَّبِيِّ الطَّاهِرِ -

मुन्द-र-जओे बावा दुइद शरीफ़ मौकअ ब मौकअ अक ही सांस में 11 मर्तबा पढ लीजिये **اِنَّ كَسْبَ اللّٰهِ عَزَّوَجَلَّ** मुंड की बढभू जाईल (या’नी दूर) हो जाओगी. अक ही सांस में पढने का बेहतर तरीका येह है के मुंड बन्द कर के आहिस्ता आहिस्ता नाक से सांस लेना शुइअ कीजिये और मुम्किना हद तक हवा इँइडों में भर लीजिये. अब दुइद शरीफ़ पढना शुइअ कीजिये. यन्द बार इस तरह मशक

करमाने मुस्तकी : عَلَى اللَّهِ تَعَلَّى عَلَيْهِ وَاللَّهُ وَسَمَّ : जिस के पास मेरा जिक्र हो और वोह मुज पर दुरद शरीक न पढे तो वोह लोगो में से कजूस तरीन शप्स है. (अरबी)

करेंगे तो सांस टूटने से कबल **لَا إِلَهَ إِلَّا اللَّهُ عَزَّ وَجَلَّ** मुकम्मल ग्यारह बार दुरद शरीक पढने की तरकीब बन जायेगी. मजकूर तरीके पर नाक से गहरा सांस ले कर मुम्किन हद तक रोक रबने के बाद मुंह से पारिज करना सिद्धत के लिये इन्तिहाई मुझीह है. दिन भर में जब जब मौकअ मिले बिल फुसूस फुली इजा में रोजाना यन्द बार तो ऐसा कर ही लेना चाहिये. मुजे (या'नी सगे मदीना **عَلَيْهِ** को) अक सिन रसीदा (या'नी बूढे) हकीम साहिब ने बताया था के मैं सांस लेने के बाद आधे घन्टे तक (या कहा) दो² घन्टे तक हवा को अन्दर रोक लेता हूं और इस दौरान अपने विर्दो वजाईक भी पढ सकता हूं. बकौल उन हकीम साहिब के सांस रोकने के जैसे जैसे मशशाक (या'नी मशक के माहिर हो जाने वाले लोग) भी दुन्या में होते हैं के सुब्ह सांस लेते हैं तो शाम को निकालते हैं !

इस्तिन्जा खाने मस्जिद से कितनी दूर खोने चाहियें ?

बारगाहे र-अविथत में सुवाल हुवा के नमाजियों के लिये इस्तिन्जा खाने मस्जिद से कितनी दूर बनाने चाहियें ? इस पर मेरे आका आ'ला हजरत इमामे अहले सुन्नत मुजदिदे दीनो मिल्लत मौलाना शाह इमाम अहमद रजा खान **عَلَيْهِ رَحْمَةُ الرَّحْمَنِ** ने जवाबन इर्शाद इरमाया : मस्जिद को भू से बयाना वाजिब है व लिहाजा मस्जिद में मिट्टी का तेल जलाना हराम, मस्जिद में दिया सलाह (या'नी बदबूदार बाइद वाली मायिस की तीली) सुलगाना हराम, हत्ता के हदीस में इर्शाद हुवा : मस्जिद में कय्या गोशत ले खाना जाईज नहीं. (ابن ماجه 16 ص 413 حديث 748) हालांके कय्ये गोशत की भू बहुत फकीक (या'नी हलकी) है. तो जहां से मस्जिद में भू पडोये

કરમાને મુસ્તફા ﷺ : على الله تعالى عليه والله وسلم : उस शप्स की नाक पाक आवूद हो जिस के पास मेरा जिक्र हो और वोह मुज पर दुइदे पाक न पड़े. (५)

વહાં તક (ઈસ્તિન્જા ખાને બનાને કી) મુમા-ન-અત કી જાએગી. (ફતાવા ર-ઝવિયા, જિ. 16, સ. 232) કચ્ચે ગોશત કી બદબૂ હલકી હોતી હૈ જબ યેહ ભી મસ્જિદ મેં લે જાના જાઈઝ નહીં તો કચ્ચી મછલી લે જાના બદ-ર-જએ ઔલા ના જાઈઝ હોગા કચ્ચે ઈસ કી બૂ ગોશત સે ઝિયાદા તેઝ હોતી હૈ બટ્કે બા'ઝ અવકાત પકાને વાલોં કી બે એહતિયાતી કે સબબ ઈસ કા સાલન ખાને સે હાથ ઔર મુંહ મેં ના ગવાર બૂ હો જાતી હૈ. એસી સૂરત મેં બૂ દૂર કિયે બિગૈર મસ્જિદ મેં ન જાએ. ઈસ્તિન્જા ખાનોં કી જબ સફાઈ કી જાતી હૈ ઉસ વક્ત બદબૂ કાફી ફૈલતી હૈ લિહાઝા (ઈસ્તિન્જા ખાને ઔર મસ્જિદ કે દરમિયાન) ઈતના ફાસિલા રખના ઝરૂરી હૈ કે સફાઈ કે મૌકઅ પર ભી બદબૂ મસ્જિદ મેં દાખિલ ન હો સકે. ઈસ્તિન્જા ખાને ઈહાતએ મસ્જિદ મેં ખુલતે હોં તો ઝરૂરતન દીવાર પાટ કર બાહર કી જાનિબ દરવાઝે નિકાલ કર ભી બદબૂ સે મસ્જિદ કો બચાયા જા સકતા હૈ.

અપને લિબાસ વગૈરા પર ગૌર કરને કી આદત બનાઈયે

મસ્જિદ મેં બદબૂ લે જાના હરામ હૈ. નીઝ હર તરહ કે બદબૂ વાલે શપ્સ કા દાખિલ હોના ભી હરામ હૈ. મસ્જિદ મેં કિસી તિન્કે સે ખિલાલ ભી ન કરેં કે જો પાબન્દી સે હર ખાને કે બા'દ ઈસ કે આદી નહીં હોતે ખિલાલ કરને સે ઉન કે દાંતોં સે બદબૂ નિકલતી હૈ. મો'તકિફ ફિનાએ મસ્જિદ મેં ભી ઈતની દૂર દાંતોં કા ખિલાલ કરે કે બદબૂ અસ્લે મસ્જિદ મેં દાખિલ ન હો. બદબૂદાર ઝખ્મ વાલા યા વોહ મરીઝ જિસ ને પેશાબ યા પાખાને કી થેલી (Urine bag Stool bag) લગાઈ હુઈ હૈ વોહ મસ્જિદ મેં દાખિલ ન હોં. ઈસી તરહ લેબોરેટરી ટેસ્ટ કરવાને કે લિયે લી હુઈ ખૂન યા પેશાબ કી

﴿ફરમાને મુસ્તકા﴾ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज पर रोजे जुमुआ दो सो बार दुरेद पाक पढा उस के दो सो साल के गुनाह मुआफ़ होंगे. (अमाल)

શીશી, ઝબીહા કે બ વક્તે ઝબહ નિકલે હુએ ખૂન સે આલૂદ કપડે વગૈરા કિસી ચીઝ મેં ઘુપા કર ભી મસ્જિદ કે અન્દર નહીં લે જા સકતે યુનાન્થે ફુ-કહાએ કિરામ رَحِمَهُمُ اللهُ السَّلَام ફરમાતે હૈં : મસ્જિદ મેં નજાસત લે કર જાના અગર્યે ઉસ સે મસ્જિદ આલૂદા ન હો યા જિસ કે બદન પર નજાસત લગી હો ઉસ કો મસ્જિદ મેં જાના મન્અ હૈ. (رَدُّ الْمُحْتَار ٢٤ ص ١٧٠) મસ્જિદ મેં કિસી બરતન કે અન્દર પેશાબ કરના યા ફસ્દ કા ખૂન લેના (મ-સલન ટેસ્ટ કે લિયે સિરિન્જ કે ઝરીએ ખૂન નિકાલના) ભી જાઈઝ નહીં. (رَدُّ الْمُحْتَار ٢٤ ص ١٧٠) પાક બદબૂ ઘુપી હુઈ હો જૈસા કે અક્સર લોગોં કે બદન મેં પસીને કી બદબૂ હોતી હૈ મગર લિબાસ કે નીચે ઘુપી હુઈ હોતી હૈ ઔર મહસૂસ નહીં હોતી તો ઈસ સૂરત મેં મસ્જિદ કે અન્દર જાને મેં કોઈ હરજ નહીં. ઈસી તરહ અગર રુમાલ મેં પસીને વગૈરા કી બદબૂ હૈ જૈસા કે ગરમી મેં મુંહ કા પસીના પોંછને સે અક્સર હો જાતી હૈ તો ઐસા રુમાલ મસ્જિદ કે અન્દર ન નિકાલે, જેબ હી મેં રહને દે, અગર ઈમામા યા ટોપી ઉતારને સે પસીને યા મૈલા કુચૈલ વગૈરા કી બદબૂ આતી હૈ તો મસ્જિદ મેં ન ઉતારે. યુનાન્થે ઈસ કી મિસાલ દેતે હુએ મુફ્સિરે શહીર હકીમુલ ઉમ્મત હઝરતે મુફ્તી અહમદ યાર ખાન رَحْمَةُ اللهِ عَلَيْهِ ફરમાતે હૈં : “હાં અગર કિસી સૂરત સે મિટ્ટી કે તેલ કી બદબૂ ઉડા દી જાએ યા ઈસ તરહ લેમ્પ વગૈરા મેં બન્દ ક્રિયા જાએ કે ઈસ કી બદબૂ ઝાહિર ન હો તો (મસ્જિદ મેં) જાઈઝ હૈ.” (ફતાવા નઈમિયા, સ. 49) હર મુસલ્માન કો અપને મુંહ, બદન, રુમાલ, લિબાસ ઔર જૂતી ચપ્પલ વગૈરા પર ગૌર કરતે રહના ચાહિયે કે ઈસ મેં કહીં સે બદબૂ તો નહીં આ રહી ઔર ઐસા મૈલા કુચૈલા લિબાસ પહન કર ભી મસ્જિદ મેં ન આએ જિસ સે લોગોં કો ઘિન આએ. અફ્સોસ ! દુન્યવી અફ્સરોં

﴿إِنَّ عَرَىٰ﴾. (अबुलखैर)। मुज पर दुइद शरीफ पढे अल्लाह उरुम पर रहमत भेजेगा. ﴿صَلَّى اللّٰهُ تَعَالَىٰ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ﴾. इरमाने मुस्तफा

वगैरा के पास तो उम्हा लिबास पहन कर जाअें और अपने प्यारे प्यारे परवर दगार एउरुम के दरबार में छाजिरी के वक्त या'नी नमाज में नफासत (सफाई और पाकीजगी वगैरा) का कोई अेहतिमाम न करें. मस्जिद में आते वक्त इन्सान कम अज कम वोड लिबास तो पहने जो दा'वतों में पहन कर जाता है. मगर इस बात का ખयाल रबिये, के लिबास शरीअत व सुन्नत के मुताबिक हो.

मस्जिद में बर्ये को लाने की मुमा-न-अत

सरकारे मदीना, सुल्ताने बा करीना, करारे कल्बो सीना, ईज गन्जना ﴿صَلَّى اللّٰهُ تَعَالَىٰ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ﴾ का इरमाने बा करीना है : मस्जिदों को बर्यों और पागलों और भरीदो इरोफ्त और जगडे और आवाज भुलन्द करने और हुदूद काईम करने और तलवार भीयने से बयाओ.

(अबुलखैर ज १०६० इरुद १०००)

ऐसा बर्या जिस से नजासत (या'नी पेशाब वगैरा कर देने) का खतरा हो और पागल को मस्जिद के अन्दर ले जाना इराम है अगर नजासत का खतरा न हो तो मकडूड. जो लोग जूतियां मस्जिद के अन्दर ले जाते हैं उन को इस का खयाल रबना याहिये के अगर नजासत लगी हो तो साफ कर लें और जूता पहने मस्जिद में यले जाना बे अ-दबी है. (रुदुलमुहताज २/१०८) बर्ये या पागल (या बेडोश या जिस पर जिन्न आया हुवा हो उस) को दम करवाने के लिये याडे "पेम्पर" लगा हो तब त्नी मस्जिद में ले जाने की शरीअत में इजाजत नही. अगर आप ऐसों को मस्जिद में लाने की भूल कर युके हैं तो बराअे करम ! इरैन तौबा कर के आयन्दा न लाने का अहूद कीजिये. हां इनाअे मस्जिद म-सलन इमाम साडिब के हुजरे में ले जा सकते हैं जबके मस्जिद के अन्दर से ले कर न गुजरना पडे.

﴿ ईरमाने मुस्तफ़ि : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : मुज़ पर कसरत से दुरेद पाक पढो बेशक तुम्हारा मुज़ पर दुरेद पाक पढना तुम्हारे गुनाहों के लिये मक्किरत है. ﴾ (भाग १)

गोशत, मछली बेयने वाले

गोशत या मछली बेयने वाले के लिबास में सप्त बढभू होती है लिहाजा एन को याहिये के इरिग हो कर अख़ी तरह नहाअें, साइ लिबास जैबे तन इरमाअें, पुरशू लगाअें और इर मस्जिद में आअें. नहाना और पुरशू लगाना शर्त नहीं सिर्फ़ मश्वरतन अर्ज़ किया है, कोई त्मी अैसी तरकीब करें के बढभू मुकम्मल तौर पर जाईल (या'नी दूर) हो जाअे.

सोने से मुंड में बढभू हो जाती है

सोते में पेट की गन्दी हवाअें ठीपर की तरफ़ उठती हैं, लिहाजा बेदार होने पर मुंड में अक्सर बढभू होती है. एस ज़िन्न में इतावा र-जविय्या जिह्द 23 सइहा 375 ता 376 से "सुवाल जवाब" मुला-हजा हों. सुवाल : सोने से उठ कर आ-यतुल कुर्सी पढना कैसा है? आ'ज उस्ताद हुक्का पीते हैं और शागिर्द को (कुरआने करीम) पढाते जाते हैं. जवाब : सोने से उठ कर हाथ धो कर कुल्ली कर ले एस के आ'द आ-यतुल कुर्सी पढे, अगर मुंड में हुक्के वगैरा की बढभू हो या कोई पाने पीने की चीज़ हो तो बिगैर कुल्ली किये तिलावत न करे. जो उस्ताद अैसा करते हैं बुरा करते हैं. وَاللّٰهُ تَعَالَىٰ اَعْلَمُ (इतावा र-जविय्या, जि. 23, स. 375, 376) हमारे मुअत्तर मुअत्तर आका صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का वुजूदे मस्जिद हर वक्त महकता रहता था, मिजाजे मुबारक में निहायत नइसत थी, मिस्वाक सोते वक्त सिरहाने रहती, उठते तो सभ से पहले मिस्वाक करते. اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ सोने में सिरहाने मिस्वाक रचना और उठ कर मिस्वाक करना सुन्नत हुवा. रसूलुदलाह صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ जब नींद से बेदार होते तो मिस्वाक करते थे.

(अबुदावुदज १/५६० हदिथ ०७)

﴿ یرمانه مستذکار علی اللہ تعالیٰ علیہ و آلہ وسلم : જો મુઝ પર એક દુરુદ શરીફ પઢતા હે અલ્લાહ ઉસ કે લિયે એક કીરાત અજ લખતા હે ઓર કીરાત ઉહુદ પહાડ જિતના હે. (મવાઝ) ﴾

બા'ઝ ગિઝાઓ કી વજહ સે પસીને મેં બદબૂ

બા'ઝ ગિઝાએ ઐસી હોતી હેં જિન કે ખાને સે બદબૂદાર પસીના આતા હે ઐસે અફરાદ ગિઝાએ તબ્દીલ ફરમાએ.

મુંહ કી સફાઈ કા તરીકા

જો મિસ્વાક ઓર ખાને કે બા'દ ખિલાલ નહીં કરતે ઓર દાંતોં કી સફાઈ કરને મેં સુસ્ત હોતે હેં અક્સર ઉન કે મુંહ બદબૂદાર હોતે હેં. સિફ રસ્મી તૌર પર મિસ્વાક ઓર ખિલાલ કા તિન્કા દાંતોં સે મસ (TOUCH) કર દેના કાફી નહીં હોતા. મસૂદે ઝખ્મી ન હોં ઈસ એહતિયાત કે સાથ મુશ્કિના સૂરત મેં ગિઝા કા એક એક ઝર્રા દાંતોં સે નિકાલના હોગા વરના દાંતોં કે દરમિયાની ગિઝાઈ અજઝા પડે પડે સડતે ઓર સપ્ત સડાંદ (યા'ની બદબૂ) કા બાઈસ બનતે રહેંગે. દાંતોં કી સફાઈ કા એક તરીકા યેહ ભી હે કે કોઈ ચીઝ ખાને ઓર ચાય વગૈરા પીને કે બા'દ ઓર ઈસ કે ઈલાવા ભી જબ જબ મૌકઅ મિલે મ-સલન બૈઠે બૈઠે કોઈ કામ કર રહે હેં ઉસ વક્ત પાની કા ઘૂંટ મુંહ મેં ભર લેં ઓર જુમ્બિશેં દેતે રહેં યા'ની હિલાતે રહેં, ઈસ તરહ મુંહ કા કચરા ઓર મૈલ કુચૈલ સાફ હોતા રહેગા. સાદા પાની ભી ચલ જાએગા ઓર અગર નમક વાલા કાબિલે બરદાશત ગર્મ પાની હો તો યેહ ﴿ یرمانه مستذکار علی اللہ تعالیٰ علیہ و آلہ وسلم ﴾ બેહતરીન “માઉથ વોશ” સાબિત હોગા.

દાઢી કો બદબૂ સે બચાઈયે

દાઢી મેં અક્સર ગિઝાઈ અજઝા અટક જાતે હેં, સોને મેં બા'ઝ અવકાત મુંહ કી બદબૂદાર રાલ ભી દાખિલ હો જાતી હે ઓર ઈસ તરહ બદબૂ આતી હે લિહાઝા વક્તન ફ વક્તન સાબુન સે દાઢી ધો લેના મુનાસિબ હે. ઈસી તરહ સર કે બાલ ભી વક્તન ફ વક્તન

इरमाने मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने क़िताब में मुज़ पर दुरुद पाक लिखा तो ज़ब तक मेरा नाम उस में रहेगा फिरिश्ते उस के लिये इस्तिफ़ार करते रहेंगे. (अबू)

धोते रहिये. इरमाने मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : “जिस के बाल हों उन का इकराम करे.” (अबूदावूद ज ६ व १०३ हदीथ ६११३) या’नी इन्हें धोअे, तेल लगाअे और कंधी करे. (अशैए लामैत ज ३ व ११४)

पुरुषूदार तेल बनाने का आसान तरीका

सर में सरसों का तेल डालने वाला सर से टोपी या इमामा उतारता है तो आ’ज़ अवकात बढबू का त्पका निकलता है लिहाज़ा जिस से बन पडे वोह उम्दा पुरुषूदार तेल डाले पुरुषूदार तेल बनाने का अेक आसान तरीका येह भी है के ओपरे के तेल की शीशी में अपने पसन्दीदा इत्र के यन्द कतरे डाल कर डल कर लीजिये. पुरुषूदार तेल तय्यार है. (पुरुषूदार तेल बनाने के मप्सूस अेसेन्स भी पुरुषूयात की दुकानों से हासिल किये जा सकते हैं) सर के बालों को वक्तन इ वक्तन साबुन से धोते रहिये.

डो सके तो रोज नडाईये

जिस से बन पडे वोह रोजाना नडाअे, के काई हद तक बदन की बाहरी बढबू जाईल होगी और येह सिद्धत के लिये भी मुफ़ीद है. (मगर मो’तकिईन मस्जिद के गुस्ल जानों में बिला सप्त ज़रत के न नडाअें, के नमाज़ियों के लिये वुज़ू के पानी की तंगी डो सकती है और मोटर भी बार बार चलने की वजह से खराब डो सकती है नीज़ तब नडाअें जब गुस्ल जाने इनाअे मस्जिद में हों अगर पारिजे मस्जिद में हों तो गुस्ले जुमुआ की भी इजाज़त नहीं सिर्फ़ इर्ज़ गुस्ल की इजाज़त है)

इमामा वगैरा को बढबू से बयाने का तरीका

आ’ज़ इस्लामी भाई काई बडे साईज का इमामा शरीफ़ बांधने का जजबा तो रभते हैं मगर सफ़ाई रभने में कोताही कर जाते

करमाने मुस्तफ़ा على الله تعالى عليه وسلم : जिस ने मुज पर अक बार दुरद पाक पढा अदलाह उस पर दस रहमतें भेजता है. (स्)

हैं और यूँ जसा अवकात ला शुजिरी में मस्जिद के अन्दर “बदबू” फैलाने के जुर्म में इंस जाते हैं. लिहाजा म-दनी इस्तिजा है के इमामा, सरबन्द शरीफ़ और यादर इस्ति’माल करने वाले इस्लामी भाई मौसिम के अ’तिबार से या ज़रतन मजीद जल्दी जल्दी इन्हें धोने की तरकीब बनाते रहें, वरना मैल कुयैल, पसीना और तेल वगैरा के सबब इन चीजों में बदबू हो जाती है, अगर्चे फुद को महसूस नहीं होती मगर दूसरों को बदबू के सबब काफ़ी घिन आती है, फुद को इस लिये पता नहीं चलता के जिस के पास जियादा देर तक कोई मफ्सूस पुश्बू या बदबू हो इस से उस की नाक अट जाती है.

इमामा कैसा होना चाहिये

सप्त टोपी पर बंधे बंधाये इमामे का इस्ति’माल भी इस के अन्दर बदबू पैदा कर सकता है. अगर हो सके तो बारीक मलमल के डलके कुलके कपडे का इमामा शरीफ़ इस्ति’माल कीजिये और इस के लिये कपडे की ऐसी टोपी पहनिये जो सर से चिपडी हुई हो के ऐसी टोपी पहनना भी सुन्नत है. बंधा बंधाया इमामा शरीफ़ सर पर रख लेने और उतार कर रख देने के बजाये बांधते वक्त अक अक पेय कर के बांधिये और इसी तरह फोलने की तरकीब कीजिये. और बार बार हवा लगने की वजह से **بَدْبُوءٌ** भी दूर होगी. इमामा व सरबन्द शरीफ़, यादर और लिबास वगैरा को उतार कर धूप में डालने से भी पसीने वगैरा की बदबू दूर हो सकती है. नीज इन पर अख़री अख़री निथ्यतों के साथ उम्दा इत्र लगाते रहना भी बदबू को दूर कर सकता है. जिम्नन इत्र लगाने की निथ्यतें और मवाकेअ भी मुला-हजा इरमा लीजिये :

ફરમાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો શખ્સ મુઝ પર દુરૂદ પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રાસ્તા ભૂલ ગયા. (ખુરાન)

ખુશબૂ લગાને કી નિયતેં ઓર મવાકેઅ

ફરમાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : “મુસલમાન કી નિયત

ઉસ કે અમલ સે બેહતર હે.” (1) (السُّنَنُ الكُبْرَى ج ٦ ص ١٨٥ حدیث ٥٩٤٢) (2) લગાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ હે ઈસ લિયે ખુશબૂ લગાઉંગા (3) લગાને સે કબલ બિસ્મિલ્લાહ (4) ખુશબૂ આને પર લગાતે હુએ દુરૂદ શરીફ ઓર (5) લગાને કે બા'દ અદાએ શુક્રે ને'મત કી નિયત સે કહૂંગા (6) મલાએકા ઓર (7) મુસલમાનોં કો ફરહત (ખુશી) પહોંચાઉંગા (8) અકલ બઢેગી તો અહકામે શર-ઈ યાદ કરને ઓર સુન્નતેં સીખને પર કુવ્વત હાસિલ કરૂંગા (9) ઇમામ શાફેઈ કહી ફરમાતે હેં : ઉમ્દા ખુશબૂ લગાને સે અકલ બઢતી હે. (10) (احیاء العلوم ج ٧ ص ٢٤٤) (11) લિબાસ વગૈરા સે બદબૂ દૂર કર કે મુસલમાનોં કો ગીબત કે ગુનાહોં સે બચાઉંગા (કયૂંકે કિસી મુસલમાન કા લિબાસ વગૈરા બદબૂદાર હો તો બિલા ઈજાઝતે શર-ઈ ઉસ કે પીછે સે મ-સલન ઈસ તરહ કહના કે “ઈસ કે લિબાસ યા હાથોં યા મુંહ સે બદબૂ આ રહી થી” ગીબત હે) (12) મૌકઅ કી મુના-સબત સે યેહ નિયતેં ભી કી જા સકતી હેં મ-સલન (13) નમાઝ કે લિયે ઝીનત હાસિલ કરૂંગા (14) મસ્જિદ (15) નમાઝે તહજજુદ (16) જુમુઆ (17) પીર શરીફ (18) ર-મઝાનુલ મુબારક (19) ઈદુલ ફિત્ર (20) ઈદુલ અઝહા (21) શબે મીલાદ (22) ઈદે મીલાદુન્નબી صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ (23) જુલૂસે મીલાદ (24) શબે મે'રાજુન્નબી صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ (25) શબે બરાઅત (26) ગ્યારહવીં શરીફ (27) યૌમે રઝા (28) દર્સે કુરઆન વ (29) હદીસ (30) તિલાવત (31) અવરાદો વઝાઈફ (32) દુરૂદ શરીફ (33) દીની કિતાબ કા

﴿فَرَمَانَهُ مُسْتَقْبَلًا﴾ عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुरुद पाक न पढा तलकीक वोह बढ भप्त हो गया. (अःन)

मुता-लआ (31) तदरीसे ँल्मे दीन (32) ता'लीमे ँल्मे दीन (33) इतवा नवीसी (34) दीनी कुतुब की तस्नीफ व तालीफ (35) सुन्नतों भरे ँजतिमाअ (36) ँजतिमाअे जिको ना'त (37) कुरआन प्वानी (38) दर्सै ईजाने सुन्नत (39) अलाकाई दौरा बराअे नेकी की दा'वत (40) सुन्नतों भरा बयान करते वक्त (41) आलिम (42) मां (43) बाप (44) मोमिने सालेह (45) पीर सालिब (46) मूअे मुबारक की जियारत और (47) मजार शरीफ की हाजिरी के मवाकैअ पर भी ता'जीम की नियत से पुश्बू लगाई जा सकती है. जितनी अखी अखी नियतें करेंगे उतना ही जियादा सवाब मिलेगा. जब के नियत का मौकअ भी हो और वोह नियत शरअन दुरुस्त भी हो. जियादा याद न भी रहें तो कम अज कम दो² तीन³ नियतें कर ही लेनी याहिएं.

अै हमारै प्यारे प्यारे अद्लाह **عَزَّوَجَلَّ** आज तक हम से जितनी बार भी मस्जिद में बढबू ले जाने का गुनाह हुआ हो उस से तौबा करते हैं और येह अज़्म करते हैं के आयन्दा कभी भी मस्जिद में किसी तरह की बढबू नहीं ले जायेंगे. या रब्बे **مُسْتَقْبَلًا! عَزَّوَجَلَّ** हमें मसाजिद को पुश्बूदार रबने की सआदत दे. या अद्लाह **عَزَّوَجَلَّ** हमें हर तरह की जाहिरी बातिनी बढबूओं से पाक हो कर मस्जिद में हाजिरी की सआदत अता इरमा. या अद्लाह **عَزَّوَجَلَّ** हमारे पुश्बूदार सरकार **صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** के सदके हमें गुनहों की बढबूओं से नजात दे और पुश्बूओं से मलकती हुई जन्नतुल फिरदौस में अपने मुअत्तर मुअत्तर हबीब **صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** का पडोस नसीब इरमा.

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : जिस ने मुझ पर एक बार दुःखे पाक पढा अल्लाह عُزَّوَجَلَّ उस पर दस
रहमते भेजता है. (स्ल.)

વલ્લાહ જો મલ જાએ મેરે ગુલ કા પસીના

માંગે ન કભી ઈત્ર ન ફિર ચાહે દુલ્હન ફૂલ

(હદાઈકે બખ્શિશ શરીફ)

صَلُّوْا عَلَيَّ الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

અપને દાંત ગૌર સે આઈને મેં દેખ લીજિયે

બૈર ખ્વાહી કે જઝબે કે તહત સવાબ કમાને કી હિસ્ મેં અર્ઝ
હે કે અગર આપ કે દાંત મૈલે કુચૈલે યા પીલે હેં તો ખુશદિલી કે સાથ
સગે મદીના غَفِيَّة کی तरफ से यन्द् म-दनी ફૂલ કબૂલ ફરમા લીજિયે,
اِنَّ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ બહુત ફાએદા હોગા.

❖ મૈલે કુચૈલે દાંત દૂસરોં કે લિયે કરાહત ઓર ઘિન કા બાઈસ હોતે હેં

❖ મુલાકાતી વગૈરા પર મૈલે દાંત વાલે કી શખ્સિયત કા અસર અચ્છા
નહીં પડતા ❖ બ કસરત પાન ગુટકે વગૈરા ખાને વાલે ગોયા પૈસે દે કર

અપને દાંતોં કા હુસ્ન તબાહ કરતે, મુંહ કા ઘાલા ઓર કેન્સર ખરીદતે
હેં ❖ મિસ્વાક સુન્નત કે મુતાબિક અચ્છી તરહ રગડ રગડ કર કીજિયે

❖ ખાને કે બા'દ દાંતોં મેં ખિલાલ કરને કા મા'મૂલ બના લીજિયે ❖ જબ
ભી કુછ ખાએં યા ચાય વગૈરા પિયેં, કુલ્લી ભર કર ચન્દ મિનટ તક મુંહ

મેં પાની હિલાતે રહેં ઈસ તરહ મુંહ કા અન્દરૂની હિસ્સા ઓર દાંત
કિસી હદ તક ધુલ જાએંગે ❖ સોતે વક્ત હલક ઓર દાંત અચ્છી તરહ

સાફ હોને ચાહિએં, વરના ગલે મેં તક્લીફ ઓર દાંતોં પર મૈલ કી તહ
મઝબૂતી સે જમેગી, બન્દ મુંહ કે અન્દર ગિઝાઈ અજઝા સડને સે મુંહ મેં

બદબૂ હોગી ઓર જરાસીમ પેટ મેં જાને સે તરહ તરહ કી બીમારિયાં
જનમ લે સકતી હેં ❖ સોને મેં પેટ કી ગન્દી હવાએં ઊપર કો ઉઠતી હેં

લિહાઝા મુંહ બદબૂદાર હો જાતા હૈ, ઉઠ કર ફૌરન હાથ ધો કર મિસ્વાક
કર કે કુલ્લિયાં કર લીજિયે, اِنَّ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ મુંહ કી બદબૂ જાતી રહેગી.

﴿ کَرَّمَانَ مُسْتَفِیًا ۖ صَلَّی اللّٰهُ تَعَالٰی عَلَیْهِ وَاٰلِہٖ وَسَلَّمَ ۝﴾ જો શપ્સ મુઝ પર દુરૂદે પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રાસ્તા
(ભૂલ ગયા. (طریق))

બેહતરીન મન્જન

મુનાસિબ મિકદાર મેં ખાને કા સોડા ઓર ઉતના હી નમક
મિલા કર બોતલ મેં ડાલ લીજિયે, બેહતરીન મન્જન તય્યાર હે.

અગર મુવાફિક હો તો રોઝાના ઈસ સે દાંત માંઝિયે, **اِنَّ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ**
હાથોં હાથ દાંતોં કા મૈલ ઉતરતા દેખેંગે. બિલફર્જ મસૂદે યા મુંહ મેં
કિસી જગહ જલન વગૈરા મહસૂસ ફરમાએ તો મિકદાર કમ કર કે
દેખ લીજિયે, અબ ભી તક્લીફ હો તો સફાઈ કી કોઈ ઓર તદબીર
કીજિયે, દાંત બહર હાલ સાફ હોને યાહિએ.

મ-દની ફૂલ : હર તરહ કી સફાઈ સુન્નત ઓર મતલૂબે શરીઅત હે.

બદબૂ ન દહન મેં હો, દાંતોં કી સફાઈ હો

મહકાઈ દુરૂદોં કી મુંહ મેં તેરે ભાઈ હો

صَلُّوْا عَلَی الْحَبِیْب! صَلَّی اللّٰهُ تَعَالٰی عَلَی مُحَمَّد

નોટ : યેહ રિસાલા પહલી બાર 12 શા'બાનુલ મુઅઝ્ઝમ 1427 સિ.હિ.

(બ મુતાબિક 6-09-2006) કો તરતીબ પાયા ઓર કઈ બાર શાએઅ
કિયા ગયા ફિર 5 રબીઉલ ગૌસ 1433 સિ.હિ. (28-2-2012) મેં ઈસ
પર નઝરે સાની કી.

યેહ રિસાલા પઢ કર દૂસરે કો દે દીજિયે

શાદી ગમી કી તક્રીબાત, ઈજતિમાઆત, આ'રાસ ઓર
જુલુસે મીલાદ વગૈરા મેં મક-ત-બતુલ મદીના કે શાએઅ કદા
રસાઈલ ઓર મ-દની ફૂલોં પર મુશ્તમિલ પેમ્ફલેટ તક્સીમ કર
કે સવાબ કમાઈયે, ગાહકોં કો બ નિયતે સવાબ તોહફે મેં દેને કે
લિયે અપની દુકાનોં પર ભી રસાઈલ રખને કા મા'મૂલ બનાઈયે,
અખબાર ફરોશોં યા બચ્ચોં કે ઝરીએ અપને મહલ્લે કે ઘર ઘર મેં
માહાના કમ અઝ કમ એક અદદ સુન્નતોં ભરા રિસાલા યા
મ-દની ફૂલોં કા પેમ્ફલેટ પહોંચા કર નેકી કી દા'વત કી ધૂમેં
મચાઈયે ઓર ખૂબ સવાબ કમાઈયે.

તાલિબે ગમે મદીના વ
બકીઅ વ મઝિરત વ
બે હિસાબ જન્નતુલ
ફિરદૌસ મેં આકા
કા પડોસ



5 રબીઉલ ગૌસ 1433 સિ.હિ.
28-2-2012

ફેહરિસ

ઉન્વાન	ક્રમ	ઉન્વાન	ક્રમ
દુરૂદ શરીફ કી ફઝીલત	1	મુંહ કી બદબૂ કા મ-દની ઈલાજ	10
મસ્જિદ મેં બલગમ દેખ કર સરકાર કી ના ગવારી	1	ઈસ્તિન્જા ખાને મસ્જિદ સે કિતની દૂર હોને	
ફારૂકે આ'જમ ઓર મસ્જિદ મેં પુશબૂ	2	ચાહિએં ?	11
મસ્જિદે પુશબૂદાર રખિયે !	2	અપને લિબાસ વગેરા પર ગૌર કરને કી આદત બનાઈયે	12
એયર ફેશનર સે કેન્સર હો સકતા હૈ	2	મસ્જિદ મેં બચ્ચે કો લાને કી મુમા-ન-અત	14
મુંહ મેં બદબૂ હો તો મસ્જિદ મેં જાના હરામ હૈ	3	ગોશત, મછલી બેચને વાલે	15
મુંહ મેં બદબૂ હો તો નમાઝ મકરૂહ હોતી હૈ	4	સોને સે મુંહ મેં બદબૂ હો જાતી હૈ	15
બદબૂદાર મરહમ લગા કર મસ્જિદ મેં આને		બા'જ ગિઝાઓં કી વજહ સે પસીને મેં બદબૂ	16
કી મુમા-ન-અત	5	મુંહ કી સફાઈ કા તરીકા	16
કચ્ચી પિયાઝ ખાને સે ભી મુંહ બદબૂદાર હો જાતા હૈ	5	દાઢી કો બદબૂ સે બચાઈયે	16
મસ્જિદ મેં કચ્ચા ગોશત ન લે જાએ	6	પુશબૂદાર તેલ બનાને કા આસાન તરીકા	17
કચ્ચી પિયાઝ વાલે ફ્યૂમર ઓર રાઈતે સે મોહતાત રહિયે	6	હો સકે તો રોઝ નહાઈયે	17
મજમઅ મેં અગરબતી સુલગાના	7	ઈમામા વગેરા કો બદબૂ સે બચાને કા તરીકા	17
બદબૂદાર મુંહ લે કર મુસલમાનોં કે મજમઅ		ઈમામા કેસા હોના ચાહિયે	18
મેં જાને કી મુમા-ન-અત	7	પુશબૂ લગાને કી નિયતે ઓર મવાકેઅ	19
નમાઝ કે અવકાત મેં કચ્ચી પિયાઝ ખાના કેસા ?	7	અપને દાંત ગૌર સે આઈને મેં દેખ લીજિયે	21
કચ્ચી પિયાઝ ખાતે વકત બિસ્મિલ્લાહ મત પઢિયે	8	બેહતરીન મન્જન	22
મુંહ કી બદબૂ મા'લૂમ કરને કા તરીકા	9	મઆખિજો મરાજેઅ	23
મુંહ કી બદબૂ કા ઈલાજ	9	ફેહરિસ	23

માخذ ومراجع

مطبوعه	کتاب	مطبوعه	کتاب
فیضان القرآن، مجلس تدریس، مرکز الاولیاء لاہور	مراۃ الساجج	دار ابن خزیمہ بیروت	صحیح مسلم
دار المعرفۃ بیروت	در مختار	دار احیاء التراث العربی بیروت	ابوداؤد
دار المعرفۃ بیروت	رد المحتار	دار الکتب العلمیۃ بیروت	سنن نسائی
رضا فاؤنڈیشن، مرکز الاولیاء لاہور	فتاویٰ رضویہ	دار المعرفۃ بیروت	ایتن ماجہ
شعبان برادر، مرکز الاولیاء لاہور	فتاویٰ فیض الرسول	دار الکتب العلمیۃ بیروت	مسند ابی یعلیٰ
کتب اسلامیہ، سمرات	فتاویٰ نعیمیہ	دار احیاء التراث العربی بیروت	معجم کبیر
مکتبۃ المدینہ، باب المدینہ، کراچی	بہار شریعت	دار الکتب العلمیۃ بیروت	الترغیب والترہیب
☆☆☆	☆☆☆	کونسل	احیۃ المفہات

